



MAP-1604010001040400

Seat No. _____

LL. B. (Sem. IV) (W.I.F. 2016) Examination

March / April - 2018

Company Law

(New Course)

Time : 2½ Hours]

[Total Marks : 70

- સૂચના : (૧) બધાં જ પ્રશ્નોના ઉત્તર આપો.
(૨) બધાં જ પ્રશ્નો સરખા ગુણ ધરાવે છે.
(૩) તમારા જવાબના સમર્થનમાં નિર્ણિત યુકાદાઓ ટાંકો.

૧ કંપનીની વ્યાખ્યા આપી તેની મૂળભૂત લાક્ષણિકતાઓ જણાવો. અદાલત દ્વારા કંપનીનો બુરખો ઉચકવાના સિદ્ધાંતની વિગતવાર ચર્ચા કરો. ૧૪

અથવા

૧ વિજ્ઞાપન પત્ર એટલે શું ? તે અંગેની કંપની ધારાની જોગવાઈઓ જણાવો. ૧૪

૨ ડિરેક્ટરોની વ્યાખ્યા આપી તેની કાનૂની પરિસ્થિતિ જણાવો. ૧૪

અથવા

૨ આંતરિક વહીવટનો સિદ્ધાંત તેના અપવાદ સહિત વિગતવાર ચર્ચા કરો. ૧૪

૩ શેરમૂડી એટલે શું ? શેરમૂડીના પ્રકારોની વિગતવાર ચર્ચા કરો. ૧૪

અથવા

૩ કંપનીના ઓડિટરની સત્તાઓ અને ફરજોની વિગતવાર ચર્ચા કરો. ૧૪

૪ કંપનીની પુનઃરચના અને જોડાણ વિશે વિગતવાર ચર્ચા કરો. ૧૪

અથવા

૪ કંપનીના વિસર્જનની વિવિધ રીતો જણાવો. ૧૪

૫ સમજાવો : (કોઈ પણ બે) ૧૪

(૧) તરલ બોજો

(૨) સભાની નોટિસ

(૩) પ્રોક્સી

(૪) રોયલ બ્રિટિશ બેંક વિ. ટર્કવાન્ડ.

ENGLISH VERSION

- Instructions :** (1) Attempt all questions.
(2) All questions carry equal marks.
(3) Cite authorities in support of your answers.

1 Define company and its legal characteristics. Discuss when court will lift the veil of the company ? 14

OR

1 What is the meaning of prospectus ? Explain the Provisions of Companies Act about the same. 14

2 Define Directors of the company and discuss the legal status of the directors. 14

OR

2 Fully discuss about doctrine of Indoor Management with its exceptions. 14

3 What is share capital ? Fully discuss about different kinds of share capital. 14

OR

3 Fully discuss about powers and duties of an 'Auditor' of a Company. 14

4 Fully discuss about Reconstruction and Amalgamation of Company. 14

OR

4 Describe the various methods of winding up of the Company. 14

5 Discuss (any two) 14

(1) Floating charge

(2) Notice of meeting

(3) Proxy

(4) Royal British Bank V/s Tarkwand.